

ॐ मा ॐ ॐ मा ॐ ॐ मा ॐ ॐ मा ॐ ॐ मा ॐ ॐ मा ॐ



પાટોત્સવ

તા. ૯-૧૨-૨૦૧૬
શુક્રવાર

ઉપાસનાના ગૌરી શિખરને સર કરીએ

પરમના પ્યારા વહાલા આત્મીયજનો,

આજથી સત્તાવીસ વર્ષ પહેલા તા. ૯-૧૨-૧૯૮૯ ના દિવસે મા ભગવતી ગાયત્રી માતાજીએ શ્રદ્ધા ધામમાં મંગલાચરણ કર્યું હતું. શ્રદ્ધામાં માતાજીએ નિવાસ કર્યો, પોતાનું નિજધામ બનાવ્યું. સવા કરોડ મંત્રજાપની હસ્તલિખિત પ્રતોથી સમગ્ર વાતાવરણ આંદોલિત થઈ રહ્યું છે. માતાજીના પાટોત્સવના આ પાવન પર્વને ઉપાસના પર્વ તરીકે ઉજવવાનો ક્રમ સ્વીકાર્યો છે.

શ્રદ્ધા તીર્થમાં શ્રદ્ધાવાન ભાવિકોની ભક્તિને પુષ્ટ કરી માતાજીએ વાત્સલ્યની ગંગાને વહેતી કરી છે. શ્રદ્ધા ધામમાં દરરોજ સંધ્યા ટાણે સત્સંગ, જ્ઞાનગોષ્ઠિ અને આધ્યાત્મિક વાતો, અનુભવો, ભજનથી વાતાવરણમાં આનંદ, સાત્વિકતા, સકારાત્મકતા પ્રસરી રહે છે.

આજના ઉપાસના પર્વે આપણે આપણી વ્યક્તિગત ઉપાસનાનો વિકાસ કરીએ અને જીવનને શિવમય બનાવીએ. મારા આધ્યાત્મિક અનુભવના આધારે આપણે નીચે દર્શાવેલ ઉપાસનાના શિખરને સર કરવા અને શિવત્વને અનુભવવા માટે, પામવા માટે ક્રમશઃ નવ સોપાનો સર કરીએ અને આપણી જીવનયાત્રાને આધ્યાત્મિકતાના રંગે રંગી દઈએ.

નવ સોપાનો -

(૧) ઉપાસનામાં સમય, સંયમ, શિસ્ત, શ્રદ્ધા, શરણાગતિ, પ્રેમ અને ઈષ્ટ પ્રત્યે આત્મીયભાવ જરૂરી છે.

(૨) પરમની જડ ચેતન સૃષ્ટિમાં આત્મીયભાવ કેળવીએ.

(૩) બાળક સમ નિર્દોષ, નિર્મળ, સરળ બનીએ.

(૪) સાત્વિકતા, સકારાત્મકતા, સદ્ગુણો અને સેવાથી જીવનને શણગારીએ.

(૫) અનાસક્ત ભાવે કર્મ કરી મુક્તિમાર્ગના અધિકારી બનીએ.

(૬) આધ્યાત્મિક સંપત્તિને આત્મસાત કરીએ.

(૭) વાણી, વર્તન, વ્યવહારમાં એકરૂપતા દાખવીએ.

(૮) મન, વચન, કર્મથી પવિત્ર રહીએ.

(૯) મંત્રજાપ, નામસ્મરણ, પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ ને

ॐ મા ॐ ॐ મા ॐ ॐ મા ॐ ॐ મા ॐ ॐ મા ॐ ॐ મા ॐ

